

કપાસની પોકેટ માર્ગદર્શિકા



કપાસમાં ગુલાબી ઈયળનું સંકલિત નિયંત્રણ



કપાસ સંશોધન કેન્દ્ર

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, મોતીબાગ, જૂનાગઢ-૩૬૨૦૦૧



- ◆ કપાસમાં ફ્રિપ અને મત્થીંગ
- ◆ કૃષિ વિસ્તરણ પ્રકાશન શ્રેષ્ઠી નં. ૩-૧-૪૮
- ◆ પ્રકાશન વર્ષ - ૨૦૧૬-૧૭ (પ્રથમ આવૃત્તિ)
- ◆ નકલ - ૨૦૦૦ નંગા

- ◆ સંપાદક
- ડૉ. એલ. કે. ઘડુક, સંશોધન વૈજ્ઞાનિક (કપાસ)
- ડૉ. વી. વી. રાજાણી, સંશોધન વૈજ્ઞાનિક (ખાનટ પેથોલોજી)
- ડૉ. જી. કે. કાતરીયા, સંશોધન વૈજ્ઞાનિક (ખાનટ ફિઝીયોલોજી)
- ડૉ. એમ. જી. વળુ, સહ સંશોધન વૈજ્ઞાનિક (ખાનટ ભ્રીડીંગ)
- પ્રો. આર. કે. વેકરીયા, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક (એન્ટોમોલોજી)
- પ્રો. વી. એલ. કિકાણી, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક (એશ્રોનોમી)
- પ્રો. એમ. વી. વરીયા, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક (એન્ટોમોલોજી)
- શ્રી એ. આર. પટેલ, ખેતીવાડી અધિકારી
- કુ. કોમલ ડી. પટેલ, ખેતીવાડી અધિકારી

- ◆ મુદ્રક
- જ્યા ઓફસેટ, જૂનાગઢ.

કપાસમાં ગુલાબી ઈયળનું સંકલિત નિયંત્રણ

કપાસમાં મુખ્ય રોકડીયા પાકોમાં આગવું સ્થાન ધરાવે છે. ખેડૂતો કપાસના પાકને સફેદ સોનુ પણ કહે છે. દેશના અર્થકરાણમાં કપાસનો પાક મહત્વનો ભાગ ભજવે છે. કપાસમાં જીડવા કોરી ખાનાર ઈયળો જેવી કે ગુલાબી ઈયળ, કાબરી ઈયળ અને લીલી ઈયળો મુખ્ય જોવા મળે છે. તેમાં બીટીનું આગમન થતા આ ઈયળોનો નિયંત્રણ થયેલ છે. પરંતુ છેલ્લા બે વરસથી ગુલાબી ઈયળનો ઉપદ્રવ વધતો જાય છે. જેમાં કપાસમાં આવતી ઈયળો પથી ૮૦ ટકા સુધી નુકશાન કરતી જોવા મળે છે. ઈયળોની ઓળખ, તેનું જીવનચક, નુકશાન અને નિયંત્રણ માટેના ઉપાયો આપવામાં આવેલ છે.

જીવનચક અને ઓળખ :



ઈડા અવસ્થા : આ જીવાતનાં ઈડા ચપટા અને લંબગોળ આકારનાં હોય છે ને કુમળા પાનની નીચેની બાજુએ, કપાસની

હુલ—ભમરી તેમજ કળી અને નાના જીડવાની રૂવાટી ઉપર એકલ દોકલ અથવા ર થી ૧૦ની સંખ્યામાં જથ્થામાં મુકાતા હોય છે. ઈડા અવસ્થા ૪ થી ૫ દિવસની હોય છે.



ઈયળ અવસ્થા : નાની અવસ્થાની ઈયળ પીળાશ પડતાં સફેદ રંગની અને કાળા માથાવાળી હોય છે જ્યારે મોટી ઈયળ ગુલાબી રંગની હોય છે.



કોશેટો અવસ્થા : આ જીવાતનો કોશેટો આછા બદામી રંગનો હોય છે. ઈયળની છેલ્લી અવસ્થા જીડવામાં રહેલા બે બીજ એક


બીજા સાથે ભેગા કરી તેમાં કોશેટો બનાવે છે અને તેમાંથી લગભગ ૮-૨૦ દિવસે ગુલાબી ઈયળનું પુખ્ત બહાર આવે છે.



પુખ્ત અવસ્થા : કૂંદી ધારા બદામી રંગની અને આગળની પાંખો ઉપર કાળા ટપકાં હોય છે જ્યારે પાછળની પાંખોની ધારો ઉપર વાળની ઝાલર હોય છે. નર અને માદા કૂંદીનો જીવનકાળ અનુક્રમે ૧૫ અને ૨૦ દિવસનો હોય છે.

ગુલાબી ઈયળનું સંપૂર્ણ જીવન ચક સામાન્ય રીતે ૨૨-૭૭ દિવસનું હોય છે. પરંતુ પાક પુરો થયા બાદ ઈયળો સુખુમ્ત અવસ્થામાં જતાં તેનું જીવન ચક લગભગ ૧૩.૫ મહિના સુધીનું હોય છે.

ગુલાબી ઈયળ દ્વારા વિવિધ અવસ્થાએ થતું નુકશાન



- (૧) કળી અવસ્થા : કપાસના કુમળા ભાગ ખાસ કરીને કળી કે ફુલની નજીક મુકેલા ઈડા સેવાયા પછી બહાર આવેલ નાની અવસ્થાની ઈયળો કુમળી કળીઓમાં દાખલ થાય છે અને કળીઓમાંથી ફુલ ભીલે ત્યાં સુધી અંદર જીવન વિત્તિત કરે છે.



- (૨) રોઝેટેડ ફુલ અવસ્થા : કળીમાં દાખલ થયેલ ઈયળ રેશમી તાંત્રણાઓથી ફુલની પાંખડીઓ અંદરની બાજુઓને જોડી

દેતી હોય છે. જેથી કુલો પૂર્ણ ખુલતા નથી અને બંધ અવસ્થામાં જોવા મળે છે તેને રોઝેટેડ કુલ કહેવામાં આવે છે. આવા નુકશાન પામેલા કુલો સમય જતા ખરી પડે છે.



(3) લીલા જીડવા અવસ્થા : રોઝેટેડ કુલમાં રહેલી ઈયળો લીલા જીડવામાં કાણું પાડી અંદર દાખલ થયા બાદ બારીક કાણું પુરાઈ જાય છે. જેની કોઈ નિશાની રહેતી નથી. એટલે ગુલાબી ઈયળથી થતું નુકશાન બહારથી જોઈ શકતું નથી.

ઈયળ જીડવામાં રહેલા એક બીજથી બીજા બીજ સુદ્ધી આવવા—જવા માટે રેશમી તાંત્રણાનું બોગદુ બનાવે છે અને બોગદામાંથી પસાર થતા પોતાની હગાર બહાર કાઢે છે. જેના કારણો જીડવામાંનો કપાસ બગડે છે.



(૪) પૂર્ણ વિકસીત જીડવા : પુરેપુરુ નુકશાન પામેલ જીડવું અધ્ય ખુલેલી હાલતમાં જોવા મળે છે. ઘણીવાર મોટી અવસ્થાની ગુલાબી ઈયળો જમીનમાં કોશેટો બનાવવા જીડવામાંથી કાણું પાડી બહાર નીકળી જાય છે. જીડવામાં જોવા મળતા આવા કાંણામાં ફુગ અને અન્ય જીવાતોનો ઉપદ્રવ થતા રૂ ની ગુણવત્તા બગડે છે, બીજને નુકશાન થાય છે તેમજ રૂ પીલવામાં તેમજ તેલના ઉત્પાદન પર અસર થાય છે.

ઉપદ્રવ અને ફેલાવાના કારણો:

- ૧) આ જીવાતની ઈયળો પાક પુરો થયા બાદ નુકશાન પામેલ જીડવાની અંદર સુખુપ્ત અવસ્થામાં જમીનની અંદર પડી રહે છે અને બીજા વર્ષે અનુકૂળ વાતાવરણ મળતા તે કોશેટામાં ફેરવાયને તેમાંથી પુખ્ત કુદીઓ બહાર આવે છે જે નવા ઈડા મુકવાનું ચાલુ કરે છે.
- ૨) કપાસની સાંઠીઓ અને ઉપાડેલા કપાસને ખેતરની આજુબાજુ શેઢા પાળા પર ઢગલામાંથી સુખુપ્ત અવસ્થામાં ઈયળો પડી રહે છે જ્યારે વાતાવરણ અનુકૂળ મળે ત્યારે પોતાનું જીવનચક ચાલુ રાખે છે.
- ૩) આ જીવાત કપાસનો પાક ના હોય ત્યારે હોલીહોક, કાંસકી, જંગલી ભીડા ઉપર પોતાનું જીવનચક ચાલુ રાખે છે.
- ૪) આ જીવાત કપાસના આગોતરા વાવેતરમાંથી પાછિતરા વાવેતરમાં પણ ઘણીવાર ફેલાયને પોતાનું જીવનચક ચાલુ રાખે છે.
- ૫) આ જીવાતની ઈયળ નુકશાન પામેલા જીડવા, બીજમાં પણ જોવા મળતી હોવાથી, જ્યારે આવા નુકશાન પામેલા બીજને શેઢાપાળા પર કે જીનીગ ફેકટરીની આજુબાજુ ફેકી દેવામાં

આવે ત્યારે તેમાં સુખુપ્ત અવસ્થામાં છુપાયેલ ઈયળો અનુકૂળ વાતાવરણ મળતા કોશોટામાં ફેરવાયને તેમાંથી નીકળેલ ફદાઓ પોતાનું નવું જીવનચક ચાલુ રાખે છે.

- ૬) જીનીગ ફેકટરીમાં નુકશાનકારક અને વધારાના કપાસિયા આજુ બાજુ ઢગલા કરી દેવાય છે અને તેમાં આ જીવાત સુખુપ્ત અવસ્થામાં આખુ વર્ષ પડી રહે છે અને જ્યારે નવા પાકમાં હુલ આવવાનું શરૂ થાય ત્યારે તે પાછુ પોતાનું જીવનચક ચાલુ કરે છે.
- ૭) આ જીવાતનો ઉપદ્રવ કપાસની પાછલી અવસ્થાએ વધારે જોવા મળે છે તેથી ઘણીવાર ખેડુતો કપાસમાં પાછલી અવસ્થાએ દવા ઢાંટતા નથી અને તેના લીધે ગુલાબી ઈયળનું વધારે જોવા નળે છે.
- ૮) આ જીવાત હુલ, કળીઓ અને જીડવાની અંદર રહેને નુકશાન કરતી હોવાથી ખેડુતો આ જીવાતના ઉપદ્રવને જોઈ શકતા નથી.
- ૯) પિયત વિસ્તારમાં લાંબા સમયગાળા સુધી ખેતરોમાં કપાસનું હોવું જેથી તેનો જીવનચક ચાલુ રાખે છે.

ગુલાબી ઈયળના નિયંત્રણ માટે કરવાના ખેતકાર્યો

- (૧) છેલ્લી વીજી પુરી થયા બાદ ખેતરમાં ઘેટા—બકરા ચરાવવા.
- (૨) કપાસનો પાક પુરો થયા બાદ કપાસની સાંઠીઓના શેઢા પાળા ઉપર ઢગલાકે વાડ ન કરતા બાળી તેનો નાશ કરવો.
- (૩) ખેતરમાં ઊડી ખેડ કરી જમીન સૂર્યતાપમાં તપવા દેવી.
- (૪) કપાસનો પાછલો વધારાનો ફાલ લેવાનું ટાળવું.
- (૫) ખેતરના શેઢાપાળા પર જોવા મળતા હોલીહોક, કાંસકા કે જંગલી ભીડા જેવા નિંદામણનો નાશ કરવો
- (૬) કપાસનો પાક પુરો થયા બાદ ખરી પડેલા નુકશાનવાળા જીડવાનો વીજી નાશ કરવો જોઈએ.
- (૭) ખુબ વહેલી વાવેતર ન કરવા સમયસરનું વાવેતર કરવું.
- (૮) કપાસની વહેલી પાકતી જાતોનું વાવેતર કરવું તથા બિન જરૂરી પિયત ન આપવું.
- (૯) કપાસમાં કુલ આવતા પહેલા ગુલાબી ઈયળની મોજણી કરવા માટે હેકટરે ૫ થી ૮ ફેરોમેનટ્રેપ ગોઠવવા.

- (૧૦) ફેરોમેન ટ્રેપમાં ૮ થી ૧૦ નર કુંદા પકડાય ત્યારબાદ ભલામણ મુજબ રાસાયણિક દવાનો છંટકાવ શરૂ કરવો.
- (૧૧) કપાસમાં કુલ અવસ્થાએ ખેતરમાં ફરતા રોઝેટેડ કુલ (પાંખડીઓ બંધવાળા કુલ) જોવા મળે તો તોડી તેનો નાશ કરવો.
- (૧૨) ઓગષ્ટ માસથી હેકટરે ૪૦ ની સંખ્યામાં ફેરોમેન ટ્રેપ ગોડવવા જોઈએ.
- (૧૩) રાત્રીના સમયે પ્રકાશ પીજર મુકી ગુલાબી ઈયળના કુંદાઓ એકત્તીત કરી તેનો નાશ કરવો.
- (૧૪) ઓગષ્ટ—સપ્ટેમ્બર માસની શરૂઆતમાં હેકટરે ૧.૫ લાખ ટ્રાયકોગામા ભમરી અઠવાડીઓના ગાળે પાંચ વખત છોડવી.
- (૧૫) કપાસમાં કુલ અવસ્થાએ સાવજ બ્રાન્ડ બ્યુવેરીયા ૫૦ થી ૬૦ ગ્રામ/૧૦ લીટર પાણીમાં ભેણવી છંટકાવ કરવો.
- (૧૬) કપાસમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ જોવા મળે ત્યારે કાઈસોપા (લીલી કુંદી) ની ઈયળો અઠવાડીએ બે વાર ૧૦ હજાર પ્રતિ હેકટર મુજબ છોડવાથી જૈવિક નિયંત્રણ કરી શકાય.

- (૧૭) કપાસમાં કુલ અવસ્થાએ ખેતરમાં ફરતા રોઝેટેડ કુલ (પાંખડીઓ બંધવાળા કુલ) જોવા મળે તો તોડી તેનો નાશ કરવો.
- (૧૮) ખેતરમાં ખરી પડેલ નુકશાનવાળી કળીઓ, કુલ, ચાંપવા અને જીવડવાનો વીણીને નાશ કરવો.
- (૧૯) શરૂઆતમાં ઈડાનાશક જંતુનાશક દવાઓ જેવી કે પ્રોફેનોફોસ, ડી.ડી.વી.પી. કે લીમડાયુક્ત નીમતેલ કે વાનસ્પતિક દવાનો છંટકાવ કરવો જોઈએ.
- (૨૦) કપાસનો પાક ૬૦ થી ૬૫ દિવસ થાય ત્યારે ડેલ્ટામેથીન ૧% + ટ્રાયઝોફોસ ૩૫% ઈ.સી. (૧૦ મિલી/ ૧૦ લીટર પાણીમાં) મિશ્રણવાળી દવાનો છંટકાવ કરવો.
- (૨૧) કપાસ ૮૦ દિવસ આસપાસનો થાય ત્યારે સાયપરમેથીન ૫% ઈ.સી. + કલોરપાઈરીફોસ ૫૦% (૧૦ મિલી/ ૧૦ લીટર પાણીમાં) મિશ્રણવાળી દવાનો છંટકાવ કરવો.
- (૨૨) કપાસ ૧૦૦ દિવસનો થાય એટલે ફરીની પ્રોફેનોફોસ ૪૦% + સાયપરમેથીન ૪% ઈ.સી. (૧૦ મિલી/ ૧૦ લીટર પાણીમાં) મિશ્રણવાળી દવાનો છંટકાવ કરવો.

- (૨૩) ત્યારબાદ કલોરપાયરીઝોસ ૧૫% + આલ્ફામેથીન ૧% ઈ.સી. (૧૦ મિલી/ ૧૦ લીટર પાણીમાં) મિશ્રાણવાળી દવાનો છંટકાવ કરવો.
- (૨૪) થાયોમીથોક્ઝામ ૧૨.૫ % + લેમડા સાયહેલોથીન ૮.૫% (૧૦ મિલી/૧૦ લીટર પાણીમાં) મિશ્રાણવાળી દવાનો છંટકાવ કરવો.
- (૨૫) છેલ્લા છંટકાવ ઉપરોક્ત દવાઓનો વારા ફરતી ૧૦ થી ૧૨ દિવસના અંતરે છંટકાવ કરતા રહેવું જોઈએ.
- (૨૬) એકલી રાસાયણીક જંતુનાશક દવા છાંટવાનું પ્રમાણ ૧૦ લીટર પાણીમાં નીચે પ્રમાણે આપેલ છે તે પ્રમાણે છંટકાવ કરવો.

ક્રમ	રાસાયણીક દવાનું નામ	દવાનું પ્રમાણ પ્રતિ ૧૦ લિટર પાણીમાં
૧	સ્પીનોસાડ ૪૫ એસ.સી.	૩ મિલી
૨	પ્રોફેનોફોસ ૫૦ ઈ.સી.	૨૦ મિલી
૩	બીટારાયફલુશ્રીન ૨.૫ એસ.સી.	૧૦ મિલી
૪	ઇન્ડોકાબ્ષેપ્ટ ૮ ઈ.સી. અથવા ૧૪.૫ એસ.સી.	૫ થી ૭ મિલી
૫	નોવાલ્યુરોન ૧૦ ઈ.સી.	૧૫ થી ૨૦ મિલી
૬	થાયોડીકાબ્ષેપ્ટ ૭૫ વે.પા.	૨૦ ગ્રામ
૭	કલોરપાયરીફોસ ૨૦ ઈ.સી.	૨૦ મિલી
૮	ડાયકલોરવોશ ૭૬ ઈ.સી.	૭ મિલી
૯	ટેલ્ટામેશ્નીન ૨.૮ ઈ.સી.	૧૦ મિલી
૧૦	લેમડા સાયહેલોશ્રીન ૨.૫ ઈ.સી.	૧૦ મિલી
૧૧	ટ્રાયઝોફોસ ૪૦ ઈ.સી.	૨૦ મિલી

વપરાશમાં પ્રતિબંધિત જંતુનાશક દવાઓ

પ્રતિબંધિત જંતુનાશકો/ રસાયણો :

(અ) ઉત્પાદન, આયાત અને ઉપયોગ પર પ્રતિબંધિત જંતુનાશકો

- | | |
|------------------------------|--------------------------------|
| ૧) આલીકાર્બ | ૧૪) ઈથાઈલ ડાયથ્રોમાઈડ |
| ૨) આલ્ફ્રીન | ૧૫) હેપ્ટાકલોર |
| ૩) બેન્જીન હેકજાકલોરાઈડ | ૧૬) લીન્ડેન |
| ૪) ક્રેલિયમ સાયનાઈડ | ૧૭) મેલીક હાઈડ્રોજાઈડ |
| ૫) કલોરબેન્જીલેટ | ૧૮) મેનાગ્રેન |
| ૬) કલોરડાન | ૧૯) મેટોક્ષ્યુરાન |
| ૭) કલોરરફેનવીન્ઝેસ | ૨૦) નાઈટ્રોકેન |
| ૮) ક્રોપર એસીટોએર્સેનાઈટ | ૨૧) પેરાકોર ડાયમિથાઈલ સર્કેટ |
| ૯) ડાયથ્રોમોકલોરોપ્રોપેન | ૨૨) પેન્ટાકલોરો નાઈટ્રોબેન્જીન |
| ૧૦) ડાયઅલ્ફ્રીન | ૨૩) પેન્ટાકલોરોકિનોલ |
| ૧૧) એન્જ્રીન | ૨૪) ફિનાઈલ મરક્ષ્યુરી એસિટેટ |
| ૧૨) ઈથાઈલ મરક્ષ્યુરી કલોરાઈડ | ૨૫) સોડીયમ મિથેન આસોનેટ |
| ૧૩) ઈથાઈલ પેરાથીઓન | |

(બ) ઉત્પાદન, આયાત અને ઉપયોગ પર પ્રતિબંધિત જંતુનાશક બનાવટો

- ૧) કાલોક્ષ્યુરાન ૫૦% S.P.
- ૨) મીથોમીલ ૧૨.૫%
- ૩) મીથોમીલ ૨૪%
- ૪) ફેસ્ફામીડ ૮૫% S.L.

(નોંધ : ભારત સરકારના તા.૨૦/૧૦/૨૦૧૫ ના જાહેરનામા મુજબ)

ઉપયોગી ટેલીફોન નંબર

નામ

મોબાઇલ નં

ઉપયોગી ટેલીફોન નંબર

નામ

મોબાઈલ નં



પ્રાપ્તિસ્થાન

કપાસ સંશોધન કેન્દ્ર, જુ.કૃ.યુ. જૂનાગઢ.

ફોન : ૦૨૮૫-૨૬૭૪૧૫૦